

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૪/૨૦૧૬ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૨/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ પર કેસ કરી, ૩૪ વ્યક્તિઓને ઝડપી ૨૧૫ લીટર દેશી દારૂ અને ૧૦૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૧૨૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૨૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ ની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૦૪/૧૬

વાડજ : હર્ષીતાબહેન હરેશભાઈ પરમાર (ઉ.વ.૧૪)(રહે.સુભાષનગરનાં છાપરાં, સોરાબજી કંમ્પાઉન્ડ, જુના વાડજ) ને તા.૩૦/૩/૧૬ સાંજનાં ૭/૩૦ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી ચેતન હર્ષદભાઈ રાણા ઘર નજીકથી લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ હર્ષીતાબહેનની માતા રીટાબહેન પરમારે વાડજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી વી.જી.રાહોડ ચલાવે છે.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૦૫/૧૬

કાઇમબ્રાન્ચ : યશવંતભાઈ મગનલાલ મિસ્ત્રી (ઉ.વ.૭૮)(રહે. પ્રણવ એપાર્ટમેન્ટ, શ્રેયસ ટેકરા, આંબાવાડી) એ તા.૩૧/૩/૧૬ નારોજ કાઇમબ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે નવેમ્બર/૨૦૧૨ થી એપ્રિલ/૨૦૧૩ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી જીવ્નેશ દેસાઈ (રહે.પુનીત એપાર્ટમેન્ટ, પુનીત આશ્રમની પાછળ, મણીનગર) (ઓફીસનું સરનામું : GF/5, શાંતમ કોમ્પલેક્ષ, સરસ્વતી હાઇસ્કૂલ પાસે, મણીનગર) યશવંતભાઈને મુડી રોકાણ તથા ગોલ્ડની સ્કીમમા સોનાના રોકાણ પર સારા એવા વ્યાજની લાલચ આપી, રોકડા રૂપિયા ૭,૯૩,૭૦૦/- તથા સોનાના દાગીના તેમજ લગડીઓ મળી કુલ રૂ.૨૫ તોલા સોનુ યશવંતભાઈના ઘરેથી લઈ જઈ, પરત નહી આપી યશવંતભાઈ સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એમ. જાડેજા ચલાવે છે.

કૃષ્ણનગર: લતાબહેન બાબુભાઈ પ્રજાપતિ (રહે.વસુધા ફ્લેટ, પાર્શ્વનાથ, કૃષ્ણનગર, નવા નરોડા) એ તા.૩૧/૩/૧૬ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૨/૧૫ થી તા.૨૦/૨/૧૬ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) અજય ચૌધરી (જોઈન્ટ સેક્ટરી ઓફ ફાયનાન્સર (૨) અભિષેક ગુપ્તા (૩) જ્યોતીબહેન પટેલ(ભાવનગર ઓનલાઇન ધનલક્ષ્મી ફાયનાન્સ ગ્રુપ લીમીટેડ) (જે તમામનાં નામ-સરનામાની ખબર નથી) તેમજ ફોન નંબર ૮૧૨૮૦૨૪૮૭૧ તથા ૮૧૨૮૦૨૪૮૪૭ ના ધારકે ભેગામળી લતાબહેનને લોભામણી જાહેરાત આપી, લલયાવી ફોસલાવી, લતાબહેન પાસેથી અલગ-અલગ તારીખે કુલ રૂપિયા ૧,૧૨,૭૦૦/- મેળવી લઇ, લતાબહેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એ.રાઠોડ ચલાવે છે.

સેટેલાઇટ : હિતેષભાઈ ચંદુલાલ ખોખર (રહે.બાલેશ્વર ઉપવન, નારાયણકૃપા કોમ્પ્લેક્ષની સામે, બોપલ ધુમા રોડ) એ તા.૩૧/૩/૧૬ નારોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૨/૧૬ સાંજનાં ૫/૦૦ થી તા.૨૯/૨/૧૬ નાં કલાક ૧૨/૦૦ વાગ્યા સુધીનાં સમયગાળા દરમ્યાન સેટેલાઇટ મેડીકલ હોસ્પિટલ પાસે, સન ફોટો સામે, પોપ્યુલર સેન્ટર ખાતેથી આરોપી (૧)ઉમેશસિંગ પ્રતાપસિંગ (રહે.શાસ્ત્રીકોલોની, હોલી હોસ્પિટલ સામે, વેસ્ટ મુંબઇ) અને (૨) રાજ જાધવનું (રહે.આકૃતિ ટાવર, અંબર હોટલ પાસે, બોરીવલ્લી વેસ્ટ, મુંબઇ)એ ભેગામળી હિતેષભાઈને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી ગાડી ખરીદવાનું કહી, હિતેષભાઈની મારૂતિ રીટઝ કાર નંબર જીજે ૧૩ એન.એન.૬૨૭૬ રૂપિયા ૫,૨૫,૦૦૦/- અને ઇનોવા કાર નંબર. જીજે.૧૮.બી.એ.૯૬૯૯ કિંમત રૂપિયા ૯,૦૦,૦૦૦/- લઈ જઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.કે.વાઘેલા ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૬૦૬/૧૬

ઓઢવ : સિધ્ધાર્થ અજયકુમાર મિશ્રા (રહે.શક્તિવિજય સોસાયટી, અર્બુદાનગર રોડ, ઓઢવ) એ તા.૩૦/૩/૧૬ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૩/૧૬ રાતનાં ૧૧/૦૦ થી તા.૩૦/૩/૧૬ સવારનાં ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનનાં દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-, ચાંદીની લગડી કિંમત રૂપિયા ૭,૫૦૦/- અને રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૨,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

નજર ચુકવી ચોરી :-

સમાચાર યાદી નં.૬૦૭/૧૬

ઘાટલોડીયા : મનિષાબેન રાજેશભાઈ પટેલ (રહે, મધુવૃદ રો.હાઉસ, ઔડાનગર બગીચાની બાજુમાં, કે.કે.નગર રોડ, ઘાટલોડીયા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૧/૩/૧૬ બપોરનાં ૧૨/૧૫ થી ૧૨/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે બે અજાણ્યા ઇસમો સરદારજી જેવા દેખાવવાળા (આશરે ૨૫ થી ૩૦ વર્ષના આશરાના) ઘરના લોકરની ચાવી બનાવવાનાં બહાને ઘરની અંદર આવી, મનિષાબહેનની નજર ચુકવી, તિજોરીના લોકરમાંથી સ્ટીલના ડબ્બાનું લોક ખોલી, ડબ્બામાંથી રૂમાલની ગાંઠડીમાં બાંધી મુકેલા સોનાના દાગીના કુલ ૩૭ તોલા ૨૫૦ મીલીગ્રામ કિંમત રૂપિયા ૪,૬૫,૬૨૫/- મતાનાં નજર ચુકવી ચોરી કરી લઇ જઇ ગયા છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.સી.જાડેજા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૦૮/૧૬

વાડજ : મનીષભાઈ નટવરભાઈ સોલંકી (ઉ.વ.૨૯)(રહે.ચંદ્રભાગા હાઉસિંગ, લક્ષ્મી એપાર્ટમેન્ટ નજીક, નવા વાડજ) એ તા.૩૧/૩/૧૬ બપોરના ૨/૩૦ થી સાંજનાં ૫/૦૦ સુધીનાં સમયગાળા દરમ્યાન પોતાની સાસરીમાં મકાન લેવા સારૂ પોતાની પાસે પૈસા ન હોઈ, મનમાં લાગી આવતાં પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાડજ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કે. શ્રી સુરપાલસિંહ અજીતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.